

B.A. Semester - 2 (CBCS) Examination**March/April- 2018****PSYCHOLOGY P4 PSY. OF EFFECTIVE BEHAVIOUR
(CORE)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	મનોભાર એટલે શું? મનોભારનાં પ્રકારો વર્ણવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૧	હતાશા એટલે શું? હતાશાનાં કારણો વર્ણવો.	
પ્રશ્ન-૨	સંઘર્ષ એટલે શું? સંઘર્ષનાં પ્રકારો વર્ણવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૨	હતાશાની નિષેધક અસરોની ચર્ચા કરો.	
પ્રશ્ન-૩	લગ્ન જીવનની અપેક્ષાઓ વર્ણવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૩	જીવનસાથીની પસંદગીનાં પરિબલો વર્ણવો.	
પ્રશ્ન-૪	પ્રેમ એક સમસ્યારૂપ આવેગ-સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૪	લગ્ન કરવાનાં અને ન કરવાનાં કારણો સમજાવો.	(૧૪)
પ્રશ્ન-૫	ટૂંકમાં ઉત્તર આપો. (કોઇપણ બે)	(૧૪)
	(૧) સર્જનાત્મક વિચારણા.	
	(૨) છૂટાછેડા.	
	(૩) શિખવાની પ્રક્રિયાનાં ઘટકો.	
	(૪) આવેગિક ક્ષમતાનાં ઘટકો.	

English Version

Que-1	What is the stress? Discuss the types of stress.	(14)
	OR	
Que-1	What is frustration? Discuss the reasons of frustration.	
Que-2	What is conflict? Describe types of conflict.	(14)
	OR	
Que-2	Discuss negative effects of frustration.	
Que-3	Discuss the expectations of married life.	(14)
	OR	
Que-3	Describe the factors of selection of life partner.	
Que-4	Love as a problem of emotion.Explain.	(14)
	OR	
Que-4	Explain reasons to get married and not to marry.	
Que-5	Write answers in short. (any two)	(14)
	(1) Creative thinking.	
	(2) Divorce.	
	(3) Factors of Learning Process.	
	(4) Factors of Emotional Competence.	
